

30 June 2020

To,  
**The Secretary,**  
Department of Corporate Services,  
BSE Limited,  
25th Floor, Phiroj Jeejeebhoy Tower,  
Dalal Street, Fort,  
Mumbai: 400 001

Dear Sir/Madam,


Ref: **Company Code: 539384**  
Sub: **Published Financial Result of the Company for the Quarter and Year Ended 31<sup>st</sup> March, 2020**

Pursuant to Regulation 47 of SEBI (Listing Obligation and Disclosure Requirements), Regulations, 2015, we are enclosing copy of published Audited Financial Results (Standalone & Consolidated) for the Quarter and Year ended **31<sup>st</sup> March, 2020** in Lok Mitra (Vernacular Language) and Freepress (English daily) on **30<sup>th</sup> June, 2020**.

Kindly take the same on record.

Thanking you,

Yours faithfully,  
For, **Krishna Capital & Securities Limited**

  
**Ashokkumar Agrawal**  
**(Managing Director)**  
(DIN 00944735)



## White Coffee: Coffee is a lover, so not only black coffee, drink white coffee now, you will get many amazing benefits



Coffee is nothing short of an elixir for a coffee lover. There are also those who take coffee machines where they drink fresh coffee with coffee seeds. Yes, this type of hobby for coffee is not easily seen. Most people drink instant coffee and hence they are less aware of the type of coffee. Have you heard about white coffee? What is white coffee? Those who believe that white coffee is white colored coffee are wrong. Any type of coffee can be white, green or brown, the same is prepared from coffee beans. The major difference comes from how to roast it and how the coffee is prepared. This process also determines the effects of coffee on our health. If you prefer to drink coffee, switch to white coffee. What is white coffee?

Contrary to the name, white coffee is not white. It is definitely lighter in color than regular coffee. One of the main things that distinguishes white coffee is that it is lightly roasted and difficult to obtain. It became popular recently, when coffee giants added white coffee to their menus. For those looking for a high dose of caffeine, white coffee is the perfect option.

Facts related to white coffee  
White coffee is not white, but is very light brown. White coffee tastes less bitter than regular coffee, due to minimal roasting. It has a nutty taste with acid properties. However, you should not start your day with caffeine. White coffee contains more caffeine than regular coffee. Caffeine is reduced in roasting and therefore white coffee contains the maximum amount of caffeine.

The mild taste of coffee beans is enhanced and you can easily differentiate between different coffee beans. Health Benefits of White Coffee

Here are some of the major health benefits of white coffee: White coffee is healthier than fully roasted coffee because its characteristics persist and nutrients are not lost during the roasting process. This makes white coffee a healthier option than regular coffee.

Due to the high amount of caffeine in it, it provides more alertness and energy. Whether you have to wake up at night or in the morning, it helps to boost your energy immediately.

White coffee contains a variety of antioxidants, which help in health. White coffee is less acidic than regular coffee, which is suitable for people who suffer from acidity after drinking coffee. This is because the more coffee beans are roasted, the lower their acidic properties. Since white coffee beans are sparsely roasted, they have a low acidity content.

Due to mild roasting, white coffee contains high chlorogenic acids, which are a great antioxidant. In addition, these coffees are good for stomach health.

If you call yourself a coffee lover, then you should try white coffee. It is always good to experience different varieties and flavors.

# Covid-19 vaccine could come within 1 year: WHO chief

Brussels, However, making the vaccine available and distributing it to all will be a challenge and requires political will, Tedros Adhanom Ghebreyesus said on Thursday during a meeting with the European Parliament's Committee for Environment, Public Health and Food Safety. One option would be to give the vaccine only to those that are most vulnerable to the virus. There are currently over 100 Covid-19 vaccine candidates in various stages

Scientists predict the world may have a Covid-19 vaccine within one year or even a few months earlier, said the Director-General of the World Health Organisation even as he underlined the importance of global cooperation to develop, manufacture and distribute vaccines.



of development. Adhanom Ghebreyesus said the pandemic has highlighted the importance of global solidarity and that health should not be seen as a cost but an investment.

He added that all countries in the world must strengthen primary health care and crisis preparedness and stressed the need for EU leadership globally. While the Director-General said the situation in the EU has improved

significantly, he underlined that Covid-19 is very much still circulating globally, with more than four million new cases in the last month. One option would be to give the vaccine only to those that are most vulnerable to the virus.

There are currently over 100 Covid-19 vaccine candidates in various stages of development. Many Members of European Parliament said that the global community must cooperate including in developing, manufacturing and distributing vaccines against COVID-19 and asked when a safe vaccine could be available. Several Members of European Parliament underlined the importance of the WHO but also said it has made mistakes in its response to the pandemic. The Director-General admitted everyone makes mistakes and informed the members that an independent panel will evaluate the WHO response to the pandemic to learn from any mistakes made. It will start its work soon, he said. There are currently over 100 Covid-19 vaccine candidates in various stages of development. One option would be to give the vaccine only to those that are most vulnerable to the virus.

## Kerala Cyber Warriors hack Delhi health ministry website to expose lack of security

Kerala, The Kerala Cyber Warriors hacked the Delhi State Health Mission website on Saturday evening to allegedly expose its lack of security. A group of hackers from Kerala has gained access to the details of at least 80,000 COVID-19 patients in New Delhi by hacking the website of Delhi State Health Mission (dshm.gov.in). The website, which is currently inaccessible, has been suspended since Saturday evening after the Kerala Cyber Warriors hacked the site to allegedly expose its lack of security. On Saturday evening, the group of hackers posted on their Facebook page said that it hacked the site to protest the Delhi government's unsatisfactory "approach towards their health care personnel".

The group also raised caution against the lack of security in the site, which stores thousands of sensitive data of patients. "We were appalled to witness sensitive data stored in these servers without any security. The accessed data contains COVID-19 patients name, address, phone number, COVID-19 test result, quarantine surveillance data, airport data, passport details, hospital data, etc. The government needs to be very careful and take every possible security measures to protect the personal information of citizens," the post by the group read. The group also said that a hacker could edit manipulate and misuse the data and make profits. "The consequences can be the downfall of the entire Indian security. For instance, manipulating these data will cause miscalculations, and inaccuracy in tracking COVID-19," the post read. Kerala Cyber Warriors also said that

several hackers had planted backdoors (an undocumented portal that allows an administrator to enter the system) to the Delhi government server, which the group removed. "We tried to report to the officials about the vulnerability of the site but, as of now, we still have not received a response. Hence, we have decided to post this," it said. Speaking to The Hindu, a senior police officer from the cybercrime department in Delhi said that no police complaint has been received so far. The DSHM server remains down as on Monday morning. "We were appalled to witness sensitive data stored in these servers without any security. The accessed data contains COVID-19 patients name, address, phone number, COVID-19 test result, quarantine surveillance data, airport data, passport details, hospital data, etc.

## Maharashtra Congress protests against fuel price hike

Pune, Congress on Monday staged a protest in Maharashtra's Pune against the surge in petrol and diesel prices across the country. During the protest, Congress leader Balasaheb Thorat said: "The protest is happening all over the country today. When petrol diesel prices are hiked it impacts common man, today when the common man is in problem already due to coronavirus the government is putting another burden on them by increasing petrol and diesel prices." Former MLC Mohan Joshi cornered the Centre for the hike in fuel prices when the rates for the same are less in the international market. "Today the prices in the international market are less but still govt is taking more money from Pune for fuel. The government should provide fuel at the price of international crude oil price. The petrol and diesel which

should be provided at Rs 40 per litre are being sold at Rs 90 per litre hence the government should reduce it," he said. With the hike in fuel prices, the petrol prices stand at Rs 87.27/litre (increase by Rs 0.17), and the diesel prices stand at Rs 77.71/litre (increase by Rs 0.24) in Pune, according to a price notification of state oil marketing companies on Monday.

**UTL Industries Limited**  
Registered Office: 607 World Trade Centre Sayajigunj VADODARA-05 Script code:500426  
Tel: +91 245 2363494, Email: utlindustries@gmail.com  
Website: www.utlindustries.com, CIN: L27100GJ1989PLC012843

**EXTRACT OF AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED 31ST MARCH, 2020**

S. No.	PARTICULARS	QUARTER ENDED			YEAR ENDED		
		Audited	Unaudited	Audited	Audited	Audited	Audited
		31-Mar-20	31-Dec-19	31-Mar-19	31-Mar-20	31-Mar-19	
1	Total Income from Operations	183.83	54.56	281.51	446.07	1141.65	
2	Net Profit for the period (before Tax, Exceptional and/or Extraordinary Items)	0.16	3.87	19.25	15.11	112.81	
3	Net Profit for the period before Tax (after Exceptional and/or Extraordinary Items)	0.48	3.87	19.25	15.43	112.81	
4	Net Profit for the period after Tax (after Exceptional and/or Extraordinary Items)	0.50	2.83	12.43	11.17	79.33	
5	Total Comprehensive Income for the period (Comprising Profit/Loss) for the period (after Tax) and Other Comprehensive Income (after Tax)	0.50	2.83	12.43	11.17	79.33	
6	Equity Share Capital	329.55	329.55	329.55	329.55	329.55	
7	Other Equity (excluding Revaluation Reserves) as shown in the Audited Balance Sheet of the previous year	-	-	-	-	-	
8	Earning Per Share (of Rs. 10/- each) for continuing and not annualised Basic & Diluted	0.00	0.01	0.04	0.03	0.24	

**Notes:**

- The above quarterly/year ended results have been reviewed by the Audit Committee and approved by the Board of Directors of the Company at their respective meetings held on 29th June 2020.
- The figures for the quarter ended 31 March 2020 and 31 March 2019 are the balancing figures between audited figures in respect of the full financial year ended 31 March 2020 and 31 March 2019 respectively, and the unaudited published year-to-date figures upto 31st December 2019 and 31st December 2018, respectively, being the end of the 3rd Quarter of the respective financial year, which were subjected to limited review by the Statutory Auditors.
- Company operates in two segments viz. Construction and SMS Services. However, Company has not commenced its operations in SMS services. Hence, Segment Reporting as defined in Ind AS 108 "Operating Segments" is not applicable.
- The above results for the period ended 31st March 2020 have been audited by the Statutory Auditors.
- Previous Year Figures Have Been Regrouped and Rearranged, to conform to the current period's classification.
- The Full format of Quarterly and year ended Financial Results are available on the Websites of the Stock Exchanges (www.bseindia.com) and Company's website (www.utlindustries.com)

By Order of the Board  
For UTL Industries Ltd.  
Sd/-  
Bhavik Vasanbhai Palei  
Director  
Din: 07521766

Date: 29 June 2020  
Place: Vadodara

**Hawa Engineers Ltd.**  
An ISO 9001:2008 Certified Company

"Registered office : Plot No. 129, Narol Road, Near Kashiram Textile Mill, Ahmedabad, Gujarat  
382405" II Email : cs@hawaengineers.com II Website : www.hawaengineers.com II Phone : 079-25320781, 25320782 II CIN : L29120GJ1993PLC019199 II"

**STATEMENT OF STANDALONE AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER/YEAR ENDED 31-03-2020**

Sr. No.	Particulars	Quarter ended		Year to date		Quarter ended	
		31-03-2020	31-03-2020	31-03-2020	31-03-2019	31-03-2019	31-03-2019
		Audited	Audited	Audited	Audited	Audited	Audited
1	Total Income from operations (net)	1029.37	4751.57	1473.35	-	-	
2	Net Profit/(Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary Items)	29.20	86.38	23.00	-	-	
3	Net Profit/(Loss) for the period before Tax (after Exceptional and/or Extraordinary Items)	29.20	86.38	23.00	-	-	
4	Net Profit/(Loss) for the period after Tax (after Exceptional and/or Extraordinary Items)	29.20	84.71	23.00	-	-	
5	Total Comprehensive Income for the Period (Comprising Profit/(Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax))	29.20	84.71	23.00	-	-	
6	Equity Share Capital	352.64	352.64	352.64	-	-	
7	Reserves (excluding Revaluation Reserve)	0.00	1041.42	0.00	-	-	
8	Earnings Per Share (of: 100/- each) (not annualised) Basic & Diluted	0.83	2.40	-	-	-	

**Note:**

- The above results have been reviewed by the audit committee of the Company and taken on record by the Board of Directors of the Company in its meeting held on 29/06/2020 and same are also reviewed by the statutory auditors of the Company.
- The above is an extract of the detailed format of Quarterly/Yearly Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly/ Yearly Financial Results are available on the Stock Exchange websites (www.bseindia.com) and on the Company website (www.hawaengineers.com)

For: Hawa Engineers Ltd  
Sd/-  
Aslam F Kagdi  
Managing Director  
DIN: 00068779

Place: Ahmedabad  
Date: 29th June, 2020

## Webinar on the impact of COVID-19



Ahmedabad, The whole world is going through an epidemic of Corona and has had a huge impact on business as well as the economy. In such a difficult time, companies have started to think of new strategies and techniques to revitalize business and drive the economy. In one such effort, a webinar was organized by Mr. Amit Patni, Director, Campden Family Connect. Campden Family Connect is a networking platform for UHNI (Ultra High Net worth Individuals) that provides Knowledge and Business Insights for Business Families and UHNI through

Regular events and Knowledge Forums. As the lockdown opens in India, Mr. Amit Patni discusses new trends and new initiatives to help business families address the COVID-19 situation. The webinar provided information on issues like Business Risk, Social Responsibility, Impact on UHNI Investment, New Trends, Digitization of Business, R&D and Future Business Investment on Technology. The host of the webinar, Mr. Amit Patni, has a Bachelors in Commerce and an MBA from Babson College, Boston (USA). Mr. Amit Patni has led Campden Family Connect's business in India and focused on his firm's growth and strategy in the country. The Patni family has been a pioneer in the establishment of family offices since the early 2000's, devoting much of their time to the importance and purpose of the family's wealth and family offices and the efforts made by Campden. (20-4)

**KRISHNA CAPITAL & SECURITIES LTD.**

REGD. OFFICE : 403, Maunyanesh Elanza, Nr. Parekh Hospital, Shyamal Cross Road, Satellite, Ahmedabad - 380 015.  
Tel. : (079) 2676 8572, 2676 8573 Fax : + 91 - 79 - 2676 857. CIN: 667120GJ1994PLC023803, E-Mail: ksbspl@yahoo.in, Web Site: www.kcsl.co.in

**STATEMENT OF STANDALONE & CONSOLIDATED FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED ON 31ST MARCH, 2020**

Sr.	Particulars	STANDALONE				CONSOLIDATED			
		Quarter Ended		Year Ended		Quarter Ended		Year Ended	
		31-03-2020	31-03-2019	31-03-2019	31-03-2019	31-03-2020	31-03-2019	31-03-2019	31-03-2019
	Month Covered	3	3	12	12	3	3	12	12
I	Revenue From Operations	965,781	1,010,770	2,978,384	4,025,695	5,987,033	4,025,695	5,987,033	5,987,033
(a)	Net Sales/Income From Operations	965,781	1,010,770	2,978,384	4,025,695	5,987,033	4,025,695	5,987,033	5,987,033
(b)	Other Operating Income	-	-	-	-	-	-	-	-
(c)	Other Income	-	-	-	-	-	-	-	-
II	Total Income From Operations	965,781	1,010,770	2,978,384	4,025,695	5,987,033	4,025,695	5,987,033	5,987,033
(a)	Net Gain on Recognition of Financial Assets at Amortized Cost	-	-	-	-	-	-	-	-
(b)	Net Gain on Recognition of Financial Assets	-	-	-	-	-	-	-	-
III	Total Income (I+II+III)	965,781	1,010,770	2,978,384	4,025,695	5,987,033	4,025,695	5,987,033	5,987,033
IV	Expenses	-	-	-	-	-	-	-	-
(a)	Cost of Material Consumed	-	-	-	-	-	-	-	-
(b)	Purchase of Stock in Trade	890,300	-	-	890,300	-	890,300	-	890,300
(c)	Change in Investments of Financial Goods, Stock-in-Trade and Work-in-progress	175,628	152	1,588,669	173,418	1,594,989	173,418	1,594,989	
(d)	Employees Benefits Expense	252,000	252,000	1,155,560	1,008,000	3,300,000	1,008,000	3,300,000	
(e)	Finance Cost	963	963	1,012	3,852	4,049	3,852	4,049	
(f)	Depreciation & Amortisation Expenses	543,047	14,225	81,820	2,180,271	2,304,647	2,180,271	2,304,647	
(g)	Others Expense	940,685	267,140	1,672,561	3,248,979	4,238,685	3,248,979	4,238,685	
(h)	Profit/Loss Before Extraordinary Items (V-VI)	25,126	743,630	1,836,543	676,846	1,995,468	676,846	1,995,468	
(i)	Share of Profit/(Loss) of an Associate	-	-	-	-	-	-	-	-
(j)	Other Income	-	-	-	-	-	-	-	-
VI	Profit/(Loss) Before Tax (VII+VIII)	25,126	743,630	1,836,543	676,846	1,995,468	676,846	1,995,468	
VII	Tax Expense	-	-	-	-	-	-	-	-
(a)	Current Tax	-	-	-	105,588	498,697	105,588	498,697	
(b)	Deferred Tax	-	-	-	616	1,204	616	1,204	
XII	Profit/(Loss) For the Period From Continuing Operation (IX-X)	25,126	743,630	1,836,543	670,642	1,495,567	670,642	1,495,567	
XIII	Profit/(Loss) For the Period From Discontinuing Operation	-	-	-	-	-	-	-	
XIV	Tax Expenses of Discontinuing Operation	-	-	-	-	-	-	-	
XV	Profit/(Loss) For the Period From Discontinuing Operation After Tax (XIII-XIV)	-	-	-	-	-	-	-	
XVI	Profit/(Loss) For the Period (XII+XV)	25,126	743,630	1,836,543	670,642	1,495,567	670,642	1,495,567	
XVII	Other Comprehensive Income	-	-	-	-	-	-	-	
(a)	Other Comprehensive Income	-	-	-	-	-	-	-	
(b)	Items That Will Not Be Reclassified to Profit or Loss	-	-	-	-	-	-	-	
(c)	Items That Will Be Reclassified to Profit or Loss	-	-	-	-	-	-	-	
(d)	Items That Will Be Reclassified to Profit or Loss	-	-	-	-	-	-	-	
(e)	Items That Will Be Reclassified to Profit or Loss	-	-	-	-	-	-	-	
XVIII	Net Profit/(Loss) for the Period (XVI+XVII)	25,126	743,630	1,836,543	670,642	1,495,567	670,642	1,495,567	
XIX	Profit/(Loss) Per Share (of Rs. 10/-)	31,584,000	31,584,000	31,584,000	31,584,000	31,584,000	31,584,000	31,584,000	
(a)	Basic	0.01	0.24	0.49	0.18	0.47	0.18	0.53	
(b)	Diluted	0.01	0.24	0.49	0.18	0.47	0.18	0.53	

**Notes:**

- The above results which published in accordance with Regulation 33 of the SEBI (Listing Obligations & Disclosure Requirements), 2015 have been reviewed by the Audit Committee and approved by the Board of Directors of the Company in its meeting held on 29th June 2020. The financial results are in accordance with the Indian Accounting Standard (Ind AS) as prescribed under section 133 of the Companies Act, 2013 read with Rule 3 of the Companies (Indian Accounting Standards) Amendment Rules, 2016. The results have been audited by the Statutory Auditor of the Company.
- The Company has adopted Indian Accounting Standards ("Ind AS") with effect from 01st April, 2019 (Transaction date being 1st April, 2019) and accordingly these financial results for the quarter / year ended 31st March, 2020 have been prepared in accordance with the recognition and measurement principles laid down in the Ind AS prescribed under section 133 of the Companies Act, 2013 ("the act") read with the relevant rules issued thereunder and other relevant provisions of the act. The impact of transition to Ind AS has been accounted for in the Retained Earnings and the comparative previous figures have been restated accordingly.
- The recognition of Equity and Net Profit as previously reported (referred to as "Previous GAAP") and Ind AS is as under:

Particulars	Net Profit	Other Equity Reconciliation
As at 31/03/2019	2818,219	As at 31/03/2019
Net Profit / Other Equity As per Previous GAAP	1,057,517	1,125,450
Change in Inventory	658,970	658,970
Gain/(Loss) due to Mark to Market of Investment	66,950	1,298,218
Balance Sheet Approach for DTA/DTL for PPE	36	6,187
Net Profit/(Loss) Other Equity As per Ind AS	1,495,567	11,771,079

4. The Company is engaged solely finance and investment activity segment and all activities of the Company revolve around this business. The Company's business activity falls within a single business segment therefore reporting in terms of Ind AS 108 on Operating Segment is not applicable.

5. The figures of the 3 Months ended 31/03/2020 and 31/03/2019 are the balancing figures between audited figure in respect of the full financial year and the published year to date figures upto 9 months of relevant financial year which were subjected to limited review by the auditors.

6. The spread of SARS-CoV-2 virus (referred as "COVID-19") across the global and in India has contributed to a significant decline and volatility in global and Indian financial markets and a consequent in the economic activities. On March 11, 2020 COVID-19 outbreak was declared as a global pandemic by the World Health Organization. The Indian Government announced a strict 21 day lockdown on March 24, 2020 which is being extended from time to time with or without relaxations across the country based on the severity of the spread at local level.

The extent to which the COVID-19 pandemic will impact the operations and financial results of the Company and consequently the estimates and judgments made could vary on future developments, including among other things any new information concerning the severity of the COVID-19 pandemic and any action to contain its spread or mitigate its impact whether government mandated or elected by the Company, which are uncertain as at the date approval of these financial results. The Company continues to closely monitor any material changes to future economic conditions, which will be given effect in the respective future period. However, considering the overall condition of the economy and the interventions of the Government to manage the impact of economic activity the Company does not consider that there is any uncertainty regarding the assumption of going concern.

7. Figures for the previous periods have been regrouped, wherever necessary to correspond with figures of the current period.

## Disclosure of Assets and Liabilities as per Regulation 33 of SEBI (Listing Obligation and Disclosure Requirements) Regulation, 2015 As of 31st March, 2020.

Particulars	STANDALONE AS AT		CONSOLIDATED AS AT	
	As on 31/03/2020	As on 31/03/2019	As on 31/03/2020	As on 31/03/2019
<b>Assets</b>				
<b>Non-Current Assets</b>				
Property, Plants and Equipments	75,420	79,272	75,420	79,272
<b>Financial Assets</b>				
1. Investments	5,552,030	5,584,970	18,751,021	18,771,994
2. Loans	-	-	-	-
3. Other Financial Assets	-	-	-	-
Deferred Tax Assets (Net)	-	-	-	-
<b>Total Non-Current Assets (A)</b>				

